

## New East(Sarathana) Zone-B Community Halls & Party Plot Booking Form

<b>Booking Type *</b>	<input type="checkbox"/> Advance <input checked="" type="checkbox"/> Regular		
<b>Hall Name *</b>	<input type="checkbox"/> Nana Varachha Community Hall <input checked="" type="checkbox"/> Sarthana Community Hall <input type="checkbox"/> Yogichowk Community Hall <input type="checkbox"/> Mota Varachha Community Hall		
<b>Program Type *</b>	<input type="checkbox"/> <b>Educational/ Samajik Sanskrutik Karyakram</b> (શૈક્ષણિક/સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમ)	<input type="checkbox"/> <b>Religious Lectures</b> (ધાર્મિક વચન)	<input type="checkbox"/> <b>Seminars</b> (સેમીનાર)
	<input checked="" type="checkbox"/> <b>Marriage/Reception/Engagement -</b> લગ્ન/સ્વાગત/સગાઈ	<input type="checkbox"/> <b>Business Purpose(4 days or less) -</b> બિઝનેસ હેતુ(૪ દિવસ અથવા ઓછા)	<input type="checkbox"/> <b>Social/Culturer Program -</b> સામાજિક/સાંસ્કૃતિક કાર્યક્રમ
	<input type="checkbox"/> <b>Meeting(without Food &amp; Breakfast)</b> (મીટીંગ(ફૂડ એન્ડ બ્રેકફાસ્ટ વગર)	<input type="checkbox"/> <b>Shok-Sabha(without Food &amp; Breakfast)</b> (શોક સભા(ફૂડ એન્ડ બ્રેકફાસ્ટ વગર)	<input type="checkbox"/> <b>Registered working for public purposes, public trusts, associations</b> (સાર્વજનિક હેતુઓ માટે કામ કરતા રજીસ્ટર્ડ જાહેર ટ્રસ્ટ એસોસિએશનો)
	<input type="checkbox"/> <b>Baby Shower -</b> સીમંતવિધિ	<input type="checkbox"/> <b>Religious Function</b> - ધાર્મિક કાર્યક્રમ	
<b>Booking Date *</b>	DD-MM-YEAR		
<b>Name of Organization / Applicant *</b>	ABC		
	(Cheque for refund of deposit if any will be issued in above name only)		
<b>Responsible Person *</b>	ABC		
<b>Identity Card No. *</b>	XXXX-XXXX-XXXX		
<b>TAN</b>	-		
<b>GST No.</b>	-		
<b>Address For Communication*</b>	XYZ		
<b>City *</b>	XYZ		
<b>State *</b>	XYZ		
<b>Email ID *</b>	abc123@gmail.com		
<b>Phone No. *</b>	0123456789		
<b>Mobile Number*</b>	0123456789		
<b>Provide Bank Details for Refund Process if any</b>			
<b>MICR Code*</b>	01234567		
<b>Bank Account Number</b>	012345678910		
<b>IFSC Code*</b>	xyz123		

**Note:**

1. For booking payment must be made in cash/DD/Credit-Debit Card/Pay Order.
2. Advance booking to be considered as 151 days or more and regular booking considered within 150 days.
3. All parties/organizers have to observe the SMC RULES.
4. Filling Mandatory (\*)
5. You Need to Attach the Following Documents While Applying for a Community hall Booking.
  - (1) Identity Proof Attachment (Any One) (Aadhar Card,Pan Card,Election Card, Driving Licence)
  - (2) Bank Detail Attachment (Any One) (Bank Passbook 1 st page,Cancel Cheque)

ABC  
Name & Signature